

મુદ્દા નં. ૪(ખ) (૧) :- પરફોર્મિંગ આર્ટ સેન્ટરનાં કાર્યો અને ફરજોની વિગત:-

સુરત મહાનગરપાલિકા દ્વારા નગરજનોની સેવામાં પશ્ચિમ ઝોન (રાંદેર) વિસ્તારમાં આવેલ ટી.પી. સ્કીમ નં. ૩૨ (અડાજણ) ફાળવેલ પ્લોટ નં. ૯૦ ખાતે પરફોર્મિંગ આર્ટ સેન્ટર બનાવવામાં આવેલ છે. આ સમગ્ર પ્રોજેક્ટ ૬૮૧૩ ચોરસ મીટરના વિશાળ પ્લોટ એરીયામાં ફેલાયેલું છે તથા કુલ બાંધકામ રૂ.૭૫ ચોરસ મીટરમાં કરવામાં આવેલું છે. આ પ્રકારના પરફોર્મિંગ આર્ટ સેન્ટરની સુવિધા સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા વેસ્ટ ઝોન વિસ્તારમાં આવેલ આ પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે ઓડીટોરિયમ વુડન સ્ટેજ, બે ડ્રેસિંગ રૂમ તથા ડાન્સ રૂમ, મ્યુઝિક રૂમ, ડ્રોઈંગ રૂમ, સ્કલ્પટીંગ રૂમ તેમજ રેકોર્ડિંગ રૂમ તથા સ્વચ્છ પાણીની સવલત ઉપલબ્ધ છે. પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે આવેલ ઓડીટોરિયમ તથા અન્ય તમામ રૂમો શહેરીજનો, સંસ્થાઓ તેમજ અન્ય નાગરીકો માટે કાર્યક્રમોનું આયોજન કરવા માટે નિયત કરેલ સમયખંડમાં અને સુરત મહાનગરપાલિકાના નીતિ-નિયમોને આધિન ભાડેથી આપવામાં આવે છે. ઓડીટોરિયમ કે અન્ય કોઈપણ રૂમનો ઉપયોગ કરવા ભાડે રાખવા ઈચ્છુક સંસ્થા કે વ્યક્તિએ સુરત મહાનગરપાલિકાની વેબસાઈટ (www.suratmunicipal.gov.in) પરથી ઓનલાઈન અથવા પશ્ચિમ (રાંદેર) ઝોનના સીવીક સેન્ટર પરથી ડિમાન્ડ ડ્રાફ્ટ (Surat Municipal Corporation) ના નામનો અથવા રોકડ રકમથી ઓફલાઈન બુકિંગ કરાવી શકશે. વધુ માહિતી માટે પરફોર્મિંગ આર્ટ સેન્ટર નો સંપર્ક (૯૦૯૯૦૦૪૫૩૮) કરી શકે છે.

ઓડીટોરીયમ:-

પરફોર્મિંગ આર્ટ સેન્ટર ખાતે આવેલ ઓડીટોરીયમમાં ૩૦૯ બેઠકની ક્ષમતા ધરાવતું વુડન સ્ટેજ, બે ડ્રેસિંગ રૂમ તથા બેઝિક સુવિધા ધરાવે છે. આ ઓડીટોરીયમમાં સેમીનાર, પ્રવચનો, નાટક, બેલે, શાસ્ત્રીય સંગીત, નૃત્ય, રાસગરબા-વિગેરે જેવાં કાર્યક્રમોનું રિહર્સલ અને ભજવણી તથા વ્યવસાયિક કાર્યક્રમોનું આયોજન કરી શકાશે.

રેકોર્ડિંગ રૂમ :-

રેકોર્ડિંગ રૂમમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ગ્રુપ રેકોર્ડિંગ, ઓડીયો તથા ઈન્સ્ટ્રુમેન્ટલ રેકોર્ડિંગ , વોકલ રેકોર્ડિંગ, બેક ગ્રાઉન્ડ મ્યુઝિક ક્રીએશન, વોઈસ / ઓવર-ડાયલોગ રીપ્લેસમેન્ટ કરવા માટેની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

ડાન્સ રૂમ :-

ડાન્સ રૂમમાં ક્લાસીકલ તથા વિવિધ પ્રકારના ડાન્સના ટ્રેનીંગ પ્રોગ્રામ, વિવિધ પ્રકારના ઓડીશન જેવા કાર્યક્રમો કરી શકાશે જે માટે ડાન્સ રૂમમાં વુડન ફ્લોરીંગ, પ્રેક્ટીસની સરળતા માટે મીરર એસેમ્બલી, મ્યુઝિક સીસ્ટમ, આધુનિક સાઉન્ડ અને લાઈટીંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

મ્યુઝિક રૂમ :-

મ્યુઝિક રૂમનો ઉપયોગ મ્યુઝિક પરફોર્મન્સ , એન્ડ પરફોર્મન્સ પ્રેક્ટીસ તથા ક્રીએશન , ઈન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક ક્રીએશન તથા રેકોર્ડિંગ, મ્યુઝિકલ આલ્બમ મેકીંગ તેમજ મ્યુઝિકના વર્ગો વિગેરેનું આયોજન કરી શકાશે.

સ્કલ્પટીંગ રૂમ :-

સ્કલ્પટીંગ રૂમમાં પોટરી મેકીંગ, સ્કલ્પટીંગ તથા મ્યુરલ વર્કસની કામગીરી કરી શકાશે. કોમ્પ્યુટર દ્વારા ડીઝાઈન મેકીંગ વિગેરે કરવા સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે જે માટે હોટ પ્લેટ , ઈલેક્ટ્રીક પોટરી, એચીંગ પ્રેસ, સીરામીક ફરનેસનો ઉપયોગ કરી શકાશે.

ડ્રોઈંગ રૂમ :-

ડ્રોઈંગ રૂમનો ઉપયોગ ડ્રોઈંગ વર્કસ , ફાઈન આર્ટ ક્લાસીસ, પોટ્રેટ મેકીંગ, સબ્જેક્ટ ડ્રોઈંગ લાઈવ સ્ટુડીઓ / ડ્રોઈંગ, આર્ટ ડીસ્પ્લે માટે વાપરી શકાશે જે માટે વિવિધ પ્રકારના ટેબલો, ડીસ્પ્લે બોર્ડ, ઈઝલ વિગેરેનો ઉપયોગ કરી શકાશે.

ઉપર જણાવેલ તમામ સુવિધાઓનો ઉપયોગ કરવા માટે કોઈપણ વ્યક્તિ/ સંસ્થા આ જગ્યાને વધુમાં વધુ ૧૫૦ દિવસ અગાઉ બુકીંગ કરી ભાડેથી રાખી વાપરી શકશે . જે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.